

# ନୀତି ରାଜସ

ପାତ୍ର

ଅଧ୍ୟାତ୍ମିକ

ଶର୍ମିଳା ମହାନ୍ତିଷ୍ଠାନ, କାଶି

କିମ୍ବା କୁମାର, କିମ୍ବା କିମ୍ବା

ମୁଦ୍ରଣ କାର୍ଯ୍ୟକ୍ରମ । ୧୯୩୦ । ୧. ଦଶା ର ଲକ୍ଷ

# ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ ગુજરાતી કોણીરાબિંડ ત્રિમાળ ]

અનુક્રમાંક ૧૭૩૬૧ વર્ષાંક

પુસ્તકનું નામ જાબો શિર્ફુદ્ -૪૧૮

વિષય ૨૪૫ : ૪૪ : ૩૪૨૫ : ૩

# નવો શિક્ષક

---

## વાતો

---

આગવં માટે

મહિલનું અને કંપની, લિમિટેડ

હુંન્દિંધી રોડ, કોટ, સુંખાઈ

સર્વ હુક સ્વાધીન ] ૧૯૩૦ [ કિંમત ૩ રૂપાં

ગુરૂત વિદ્યાપીઠ  
અમદાવાદ  
ગુજરાતી કોપીરાઇટિંગ

મરાಠી નવા શિક્ષકનું  
ભાષાંતર કરાવનાર  
મિસ એલ. એફ. એસ્ટિન, બી. એ. •

Printed by V. P. Penlherkar, at the Tutorial Press,  
211a, Siriong Back Road, Bombay  
and

Published by F. E. Francis, for Messrs. Macmillan & Co., Ltd.,  
Fort, Bombay



# નવો શિક્ષક

## વાતાવો

વાતા પહેલી

બાપુ

૧. એક છોકરો હતો.  
 તે છોકરો જુદ્દો હતો.  
 તે છોકરો ખાડુ જુદ્દો હતો.  
 તે છોકરાનું નામ બાપુ હતું.



૨. “મા! મા! વાધ ચાંચો.  
 બાપા! બાપા! વાધ ચાંચો.  
 બંકરી પકડી! બંકરી પકડી!



વાધે બકરી પકડી ! ”



એવી રીતે તે છોકરાએ ખૂમો પાડી.  
પણ ખરેખરો વાધ આવ્યો ન હતો.  
વાધે બકરી પકડી ન હતી.  
તે છોકરો ખડુ જુદ્ધો હતો.

૩. પણ એક હિવસ ખરેખરો વાધ આવ્યો.

બાપુએ ખૂમ પાડી,  
“વાધ આવ્યો, વાધ આવ્યો !



બકરી પકડી ! બકરી પકડી !

વાધે બકરી પકડી ! ”

તે છોકરો ખડુ જુદ્ધો હતો,

આ વખતે બાપ આવ્યો નહિ.

મા આવી નહિ.

કાઈ આવ્યું નહિ.

૪. એક હિવસ ખરેખરો વાધ આવ્યો.

બાપ આવ્યો નહિ.

મા આવી નહિ.

( ૭ )



કોઈ આવ્યું નહિ.  
વાઘે ખકરી પ્કડી.  
બાપુ ધાળોજ રહ્યો.

---

## વાત્તી ખીલ

### ખળદ અને કુતરો

---

૧. એક ખળદ હતો.

ખળદને ધણી ભૂખ લાગી હતી.

એક કુતરો હતો.

કુતરા પાસે ધાસ પડેલું હતું.



૨. ખળદને ધણી ભૂખ લાગી હતી.

તે ધાસ પાસે આવ્યો.

 તેને જેઈ કુતરો ભસવા લાગ્યો.  
ખળદ ઘોટ્યો,

“ કુતરા ભાઈ, કુતરા ભાઈ, મને ખહુ ભૂખ લાગી  
છે. મને ધાસ આવા હૈ.”

૩. કુતરો યોદ્યો,

“હું તને ધાસ ખાવા નહિ દઉં.”

બળદ યોદ્યો,

“કુતરા ભાઈ, આ ધાસ તારા કામનું નથી.

મને બહુ ભૂખ લાગી છે,

મને ધાસ ખાવા હે.”

કુતરો યોદ્યો,

“મારે ધાસ કામનું નથી,

પણ હું તને ધાસ ખાવા

નહિ દઉં; જા.”

કુતરો ભસવા લાગ્યો.



“નિશાળ છૂટી પાઠી ફૂટી.  
મા, મને ભૂખ લાગી.”

### વાર્તા ત્રીજી

### મધમાખી અને કખુતર

૧. એક મધમાખી હતી.

તેને બહુ તરસ લાગી હતી.

પાસે એક નહી હતી.

તેથી મધમાખી નહી પર ગઈ.

નહી બહુ જેરથી વહેતી હતી.

તેથી મધમાખી તણાવા લાગી.

તે તણાતી હતી, તે તણાતી.

૨. તે નહીની પાસે એક જાડ હતું.

તે જાડ પર એક કખુતર ઘેરું હતું.

મધમાખી નહીમાં તણાઈ જતી હતી.

તેથી કખુતરને તેના પર દ્વા આવી.

કખુતરે જાડનું પાંદડું તોડી

નહીમાં નાખ્યું.

મધમાખી તે પાંદડા પર ઘેરી.

તે કિનારા પર આવી, તે કિનારા પર આવી,

તે કિનારા પર આવી.

૩. તે જાડ નીચે એક શિકારી આવ્યો.

શિકારી પાસે એક જળ હતી.

તે જળ તેણે નીચે પાથરી.

તેણે કખુતરને પકડવા માટે જળ પાથરી.

મધમાખીને કખુતર પર દ્વા આવી.



મધમાખી શિકારીના પજો કરડી.

“અરેરે! અરેરે!” એવી બૂમ  
તે શિકારીએ પાડી.

તે શિકારીએ બહુ જેરથી બૂમ  
પાડી.

કખુતર ઊડી ગયું, તે ઊડી ગયું.  
તે ઊડી ગયું.



## વાર્તા ચોથી

### ચંચળ અને માણેક

એક હતી ચંચળ, તેને માણેક નામે દીકરી હતી.

માણેક ગઈ જમવા.

તેને ભષ્યો પૈસો.

મા, મા, પૈસાનું શું લાવું?

મા ઓલી, ભાજ.

સાછુ કેવી રીતે કરું? સરર, સરર.

કાપું કેવી રીતે? ચરર, ચરર.

રાંધું કેવી રીતે? ખદ્ખદ.

ખાઉં કેવી રીતે? મટમટ.

સૂઈ જાઉં કેવી રીતે? હાયે પાસે.

અમારી મજાની વાર્તા પૂરી થઈ.

## વાર્તા પાંચમી

### ત્રણ એનો



એક હતી માણું.

એક હતી માણુક.

અને એક હતી હું.


માણું ગઈ કુરવા.

માણુક ગઈ કુરવા.

અને હું પણ ગઈ.

માણુને મહયો પૈસો.

માણુકને મહયો પૈસો.



અને મને મળી એક પાઈ.  
 માણું ખજરે ગઈ.  
 માણું ખજરે ગઈ.  
 હું પણ ગઈ.  
 માણીએ લિધો મકાઈદોડો.  
 માણું લિધો મકાઈદોડો.  
 અને મેં પણ લિધો.  
 માણી આવી ઘેર.  
 માણું આવી ઘેર.  
 હું પણ આવી ઘેર.  
 માણીએ શેકયો મકાઈદોડો.  
 માણું શેકયો મકાઈદોડો.  
 હું શેકવા ગઈ,  
 તો મારો મકાઈદોડો ખળી ગયો.  
 માણીએ એક દાણો આપ્યો.  
 માણું એક દાણો આપ્યો.  
 મેં તે ખાધા.  
 માણી ગઈ પાણી પીવા.  
 માણું ગઈ પાણી પીવા.



(૧૩)

હું પણ ગઈ પાણી પીવા, તો અંદરજ પડી.  
 મણીએ હાથ પકડ્યો.  
 માણેંકે હાથ પકડ્યો.  
 અને મને બહાર કાઢી.  
 પછી મને હસવું આવ્યું.



અહીં ઘેસ રે મોાર, ઘેસ રે મોાર,  
 ખાળું આપ્યો ચારો,  
 ચારો ખા, પાણી પી.

આવ રે વરસાદ, આવ રે વરસાદ,  
 તને આપું પૈસો,  
 પૈસો પડ્યો જોટો,  
 વરસાદ આપ્યો મોટો.

## વાતાં છદ્રી

### માધવ

૧. માધવ નામનો એક છોકરો હતો.  
 તે હુશિયાર હતો.

તेनामां सारा गुणु हुता.

ते रोજ निशाणे जतो.

૨. એક હિવસ નિશાળ છૂટી.

એટલે માધવ દોડીને ઘેર જતો હતો.

માધવ પાસે એક પડીકું હતું.

તે તેની માને હેખાડવા સાર્થ જતો હતો.

તે દોડીને ઘેર આવ્યો.



૩. પડીકું તેની માને આપ્યું.

માચ્યે તે છોડવા માંડ્યું.

તેણે તે છોડ્યું.

તેની અંદર એક ઈનામ હતું.

મા—“ માધવ, આ શું છે? ”

માધવ—“ મા, એ મને ઈનામ મળ્યું છે. ”

મા—“ શા માટે તને ઈનામ મળ્યું છે? ”

માધવ—“ મારી ચાલચલગત સારી છે,

એમ મને માર્સ્તરે કહ્યું.

પછી મને આ ઈનામ આપ્યું.”

માને આનંદ થયો.

તેણે માધવને શાખાશી આપી.



## વાર્તા ખાતમી

### ઉંદરની વાત



એક ઉંદર હતો.

તેને એક પૈસો મળ્યો.

તે રાજ પાસે ગયો ને બોલ્યો,

“ રાજ સાહેબ, રાજ સાહેબ, હું પૈસો કયાં મૂકું ? ”

રાજ બોલ્યો, “ જાઓ, તેને એક રૂમાલ આપો. ”

ઉંદર બોલ્યો, “ મને બાંધતાં આવડતું નથી,

મને બાંધતાં આવડતું નથી. ”

રાજ બોલ્યો, “ જાઓ, તેને બાંધી આપો. ”

ઉંદર બોલ્યો, “ મૂકવાને માટે જગા નથી, જગા નથી. ”


રાજ બોલ્યો, “ જાઓ, તેને પેટી આપો. ”



ઉંદર બોલ્યો, ‘‘ પેટી કેવી રીતે ઉંચકું,  
કેવી રીતે ઉંચકું ? ’’


રાજ બોલ્યો, “ જાઓ, તેને પેટી  
ઉપાડવા ઊંટ આપો. ”

ઉંદર બોલ્યો, “ તેની ગરદન બહુ  
લાંખી છે, બહુ લાંખી છે. ”



(૧૬)

રાજ ઘાલ્યો, “ત્યારે તેને હાથી આપો.”



ઉંદર ઘાલ્યો, “તેના સુપડા જેવા  
કાન છે, સુપડા જેવા કાન છે.”


રાજ ઘાલ્યો, “સારું, ત્યારે તેને ઘાડી  
આપો.”

ઉંદર ઘાલ્યો, “એ તો જલહી ચાલે છે,  
ખાડુ જલહી ચાલે છે.”



રાજ ઘાલ્યો, “સારું, તેને ગાડી આપો.”

ઉંદર ઘાલ્યો, “એનો ખડખડાઈ  
ખાડુ થાય છે. એનો ખડખડ-  
ડાઈ ખાડુ થાય છે.”



રાજ ઘાલ્યો, “સારું, તેને એક પાલખી આપો.”



ઉંદર ઘાલ્યો, “ખાડુ ગરમી લાગે છે,  
ખાડુ ગરમી લાગે છે.”

રાજ ઘાલ્યો, “સારું, ત્યારે તેને પૈસો પાછો આપો.”

ઉંદરે ધણા હુઃખની સાથે પૈસો પાછો લિધો.

## વાર્તા આઠમી

### નાની મરધી

---

એક મરધી હતી.

તે ખડુ નાની હતી.

તેને કેટલાક ધઉંના દાણા મળ્યા.

તેણું બિલાડીને ઘાલાવી.

તેણું બતકને ઘાલાવી.

તેણું કખુતરને ઘાલાવ્યું.

પછી તે નાની મરધી ઘાલી,

“હું ધઉં વાવીશા.

મને કોણ મદદ કરશો? ”

બિલાડી ઘાલી, “હું મદદ નહિ કરું. ”

બતક ઘાલી, “હું મદદ નહિ કરું. ”

કખુતર ઘાલ્યું, “હુ મદદ નહિ કરું. ”

પછી તે નાની મરધી ઘાલી,

“વાર્દુ, હું પોતેજ ધઉં વાવીશા.”

તેણું ધઉં વાવ્યા.

તે ધઉં પાક્યા.

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘੋਲੀ,

“ਹੁੰ ਧਉਂ ਕਾਪੁਂ ਛੁੰ.

ਮਨੇ ਕੋਣ੍ਹ ਮਫ਼ਦ ਕਰਸ਼ੇ? ”

ਬਿਲਾਡੀ ਘੋਲੀ, “ਹੁੰ ਨਹਿ ਕਾਪੁਂ.”

ਖਤਕ ਘੋਲੀ, “ਹੁੰ ਨਹਿ ਕਾਪੁਂ.”

ਕਖੁਤਰ ਘੋਲ੍ਹਿ, “ਹੁੰ ਨਹਿ ਕਾਪੁਂ.”

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘੋਲੀ,

“ਵਾੜ੍ਹ, ਤਾਰੇ ਹੁੰ ਪੋਤੇਜ ਧਉਂ ਕਾਪੀਸ਼.”

ਤੇਣੇ ਧਉਂ ਕਾਪਿਆ.

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘੋਲੀ,

“ਹੁੰ ਧਉਂ ਫਣੁੰ ਛੁੰ.

ਮਨੇ ਕੋਣ੍ਹ ਮਫ਼ਦ ਕਰਸ਼ੇ? ”

ਬਿਲਾਡੀ ਘੋਲੀ, “ਹੁੰ ਨਹਿ ਫਣੁਂ.”

ਖਤਕ ਘੋਲੀ, “ਹੁੰ ਨਹਿ ਫਣੁਂ.”

ਕਖੁਤਰ ਘੋਲ੍ਹਿ, “ਹੁੰ ਨਹਿ ਫਣੁਂ.”

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘੋਲੀ,

“ਵਾੜ੍ਹ, ਤਾਰੇ ਹੁੰ ਪੋਤੇਜ ਧਉਂ ਫਣੀਸ਼.”

ਤੇਣੇ ਧਉਂ ਫਣਿਆ.

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘੋਲੀ,

“ਹੁੰ ਪੁਰੀ ਕੱਢੇ ਛੁੰ.

ਮਨੇ ਕੋਣੁ ਮਦਦ ਕਰਸੋ? ”

ਬਿਲਾਡੀ ਘਾਲੀ, “ਹੁੰ ਪੁਰੀ ਨਹਿ ਕੜ੍ਹ.”

ਖਤਕ ਘਾਲੀ, “ਹੁੰ ਪੁਰੀ ਨਹਿ ਕੜ੍ਹ.”

ਕਖੁਤਰ ਘਾਲ੍ਯੁ “ਹੁੰ ਪੁਰੀ ਨਹਿ ਕੜ੍ਹ.”

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘਾਲੀ,

“ਵਾੜ, ਹੁੰ ਪੋਤੇਜ ਪੁਰੀ ਕਰੀਸ਼.”

ਤਣੇ ਪੁਰੀ ਕਰੀ.

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘਾਲੀ,

“ਹੁੰ ਪੁਰੀ ਤਣੁ ਛੁ.

ਮਨੇ ਕੋਣੁ ਮਦਦ ਕਰਸੋ? ”

ਬਿਲਾਡੀ ਘਾਲੀ, “ਹੁੰ ਨਹਿ ਤਣੁ.”

ਖਤਕ ਘਾਲੀ, “ਹੁੰ ਨਹਿ ਤਣੁ.”

ਕਖੁਤਰ ਘਾਲ੍ਯੁ, “ਹੁੰ ਨਹਿ ਤਣੁ.”

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘਾਲੀ,

“ਵਾੜ, ਤਧਾਰੇ ਹੁੰ ਪੋਤੇਜ ਪੁਰੀ ਤਣੀਸ਼”.

ਤਣੇ ਪੁਰੀ ਤਣੀ.

ਪਈ ਤੇ ਨਾਨੀ ਮਰਧੀ ਘਾਲੀ,

“ਹੁੰ ਪੁਰੀ ਘਾਉ ਛੁ.


ਮਨੇ ਕੋਣੁ ਮਦਦ ਕਰਸੋ? ”

ਬਿਲਾਡੀ ਘਾਲੀ, “ਮਿਥਾਂਡ! ਮਿਥਾਂਡ! ਮਿਥਾਂਡ! ਹੁੰ! ਹੁੰ! ਹੁੰ!”

ખતક ઘાલી, “કવાક ! કવાક ! કવાક ! હું ! હું ! હું !”  
 કખુતર ઘાલ્યું, “ધુરર ! ધુરર ! ધુરર ! હું ! હું ! હું !”  
 પછી તે નાની ભરધી ઘાલી,  
 “મેં પોતેજ ધઉં વાયા.  
 મેં પોતેજ ધઉં દહયા.  
 મેં પોતેજ પુરી કરી.  
 મેં પોતેજ પુરી લળી.  
 તો પછી હું પોતેજ પુરી ખાઈશા.  
 અને મારાં બરચાંને આપીશા”.  
 પછી તેણે તે પુરી બરચાંને આપી.

## વાતાઈ નવમી અનાજની વાત

એક દિવસે એક ઘેટી અને એક કુતરો અનાજ વાવવા  
 ચાલ્યાં.  
 રસ્તામાં તેમને એક ગાય  
 મળી.



(૨૧)

ઘેરી અને કુતરો બ્યાલ્યાં, “અમે અનાજ વાવવા જઈએ છીએ.”

ગાય બ્યાલી, “તું પણ આવીશ.”

ઘેરી અને કુતરો બ્યાલ્યાં,  
“તું અનાજ વાવવા  
લાગશે શું ?”

ગાય બ્યાલી, “હા, તું વાવવા  
લાગીશ.”

ઘેરી બ્યાલી, “વાર્ડ, તું પણ આવ.”  
પછી કુતરો ચાલ્યો.

ઘેરી ચાલી.


ગાય ચાલી.

તેખધાં ચાલતાં હતાં, એઠલામાં તેમને એક ખતક મળી.

કુતરો અને ગાય બ્યાલ્યાં, “અમે  
અનાજ વાવવા જઈએ  
છીએ.”

ખતક બ્યાલી, “હું પણ આવું છું.”

ઘેરી, કુતરો અને ગાય બ્યાલ્યાં, “તું અનાજ વાવવા  
લાગશે શું ?”



ખતક ઘોલી, “હા, હું વાવવા લાગ્યિશ.”

ઘેટી ઘોલી, “વારુ, તું ખણુ આવ.”

પઢી કુતરો ચાલ્યો.

ઘેટી ચાલી.

ગાય ચાલી.

ખતક ચાલી.

તેઓ ચાલ્યાં, ચાલ્યાં ને ચાલ્યાં.

પઢી ઘેટી ઘોલી,

“આપણે અહીં અનાજ વાવીશું.”

કુતરો અનાજ વાવવા  
લાગ્યો.

ગાય અનાજ વાવવા લાગ્યી.

ખતક અનાજ વાવવા  
લાગ્યી.



તે ખધાં અનાજ વાવવા લાગ્યાં.


ત્યાર પઢી તે અનાજને પાણીની જરૂર પડી.

ઘેટી ઘોલી, “આપણે કુવામાંથી પાણી લાવીએ.”

કુતરો પાણી લાવવા લાગ્યો.

ગાય પાણી લાવવા લાગ્યી.

ખતક પાણી લાવવા લાગ્યી.



તે ખધાં કુવામાંથી પાણી લાવવા લાગ્યા.

પછી અનાજ કાપવામાં આવ્યું.



ઘેરી ઘાલી, “આપણે તે  
ખજરમાં વેચ્યાશું.”

કુતરો કેટલુંક અનાજ લઈ  
ખજરમાં ગયો.

ગાય કેટલુંક અનાજ ખજરમાં લઈ ગઈ.

ખતક કેટલુંક અનાજ ખજરમાં લઈ ગઈ.

તે ખધાં અનાજ ખજરમાં લઈ ગયાં.

ત્યાર પછી તેઓએ તે અનાજ આઠ રૂપીએ વેચ્યું.

ઘેરી ઘાલી, “આપણ ખધાંને  
ખણ્ણે રૂપીએ મળશો.”

કુતરાને એ રૂપીએ  
મળ્યા.

ગાયને એ રૂપીએ મળ્યા.

ખતકને એ રૂપીએ મળ્યા.



ઘેરીને એ રૂપીઓ મળ્યા.  
તે દરેકને અનાજ વેચવાથી ખુલ્લે રૂપીઓ મળ્યા.


---

## વાર્તા હસમી શીંછનું જંગલ

---

એક દિવસ ગાય ઓલી, “હું ધાસ જેવા જંગલમાં  
જાઉં છું.”

બકરું ઓલ્યું, “હું પણ આવું છું.”  
ઘાડો ઓલ્યો, “હું પણ આવું છું.”



ઉંટ ઓલ્યું, “હું પણ  
આવું છું.”  
ગાય ઓલી, “તો આપણે  
ખધાં જઈએ.”

ખળદ ઓલ્યો, “હું આવીશા નહિ, જંગલમાં રીછ છે.”  
ગાય ઓલી, “હું રીછથી ભીતી નથી.”  
બકરું ઓલ્યું, “હું રીછથી ભીતું નથી.”  
ઘાડો ઓલ્યો, “હું પણ ભીતો નથી.”

ઉંટ બાલ્યું, “હું પણ બીતું નથી.”

ગાય બાલી, “આપણે કોઈ પણ રીછથી બીતાં નથી.”

પછી ગાય જંગલમાં ચાલી.


ખકરું પણ જંગલમાં ચાલ્યું.

ધાડો અને ઉંટ જંગલમાં ચાલ્યાં.

તે ચારે જણ જંગલમાં ગયાં.

ત્યાં તેમને લીલુંછમ ધાસ

મળ્યું.



ગાયે તે લીલુંછમ ધાસ ખાદું.

ખકરાએ પણ તે લીલુંછમ ધાસ ખાદું.

ધાડાએ અને ઉંટે પણ તે લીલુંછમ ધાસ ખાદું.

તે ચારે જણાએ તે લીલુંછમ ધાસ ખાદું.

પછી તે છાયામાં તેમને ધાણું થંડું પાણી મળ્યું.

ગાયે તે થંડું પાણી પીધું.

ખકરાએ પણ તે થંડું પાણી પીધું.

ધાડાએ અને ઉંટે પણ તે થંડું પાણી પીધું.

તે ચારે જણાએ તે થંડું પાણી પીધું.

(૨૬)

પછી સામે જોયું તો  
તેઓએ રીછને જોયું.  
રીછ ધૂર ધૂર કરવા  
લાગ્યું.

ગાય ઘાલી, “મને  
ખીક લાગે છે.”

ખકડું ઘાલ્યું, “મને ખીક લાગે છે.”

ઘાડો અને ઊંટ ઘાલ્યાં, “અમને પણું ખીક લાગે છે.”

ગાય ઘાલી, “આપણું ચારે જણને હુમણુંં ખીક  
લાગે છે.”

રીછ ધૂર કરીને ઘાલ્યું,

“તમે મારા જંગલમાં શું કરો છો?

તમે મારું લીલું ધાસ કેમ ખાયો છો?


તમે મારું થૂંદું પાણી કેમ પીયો છો?

તમે મારી સુંહર જગાએ શા માટે આવ્યાં છો?”

ગાય ઘાલી, “અમે તમારું કશું તુકસાન કરતાં નથી.

ખકડું ઘાલ્યું, “અમે ફૂકત ધાસ જોઈએ છીએ.”

ઘાડો અને ઊંટ ઘાલ્યાં, “અમે ફૂકત થૂંદું પાણી  
પીધું છે.”



(૨૭)

ગાય ઘાલો, “અમે તારા જંગલમાં કંઈ નુકસાન  
કરનાર નથી.”

રીછ ફરી ધૂર કરીને ઘાટ્યું,  
“આ જંગલમાંથી તમે નીકળી જાઓ.  
આ જંગલ માર્દ છે.  
આ લીલુંછમ ધાસ માર્દ છે.  
આ થડું પાણો માર્દ છે.  
આ સુંદર જગ્યા મારી છે.”

પછી ગાય દોડી.  
ખકડું પણ દોડ્યું.  
ઘોડો અને ઉંઠ  
દોડ્યાં.



તે ચારે જગ્યા જંગલમાંથી બહાર નીકળ્યાં, ત્યાં સુધી  
ખૂબ દોડ્યાં.

તે સધળાં રહ્યે હોડતાં હોડતાં પોતપોતાને ઘેર  
પાછાં આવ્યાં.

## વાર્તા અગિયારમી

### ઘેટીનું ધર

એક દિવસ એક ઘેટીને એક મોટો હથોડો મહયો.  
તે ઘાલી, “હું આનાથી માર્દ  
ધર બાંધિશ.”

તેણું તે ઉપાડી લીધો, અને  
રસ્તે ચાલવા લાગી.

રસ્તે તેને એક મોટો હાથી મહયો.


તેણું હાથીને ખૂબ મારી, અને ઘાલી, “સલામ,  
હાથીરાજ.”

હાથી ઘાલ્યો, “સલામ, ઘેટીબાઈ, તું કયાં જય છે ?”  
ઘેટી ઘાલી, “હું જંગલમાં જઉં છું, મારે લાકડાનું  
ધર બાંધવાનું છે.”

પછી તે હાથી ઘાલ્યો, “હું તારી સાથે આવું ?”

ઘેટી ઘાલી, “તું આવીને શું કરીશ ?”


હાથી ઘાલ્યો, “હું જાડેને પાડી નાખીશ, અને  
ઉંચકીને લાવી આપીશ.”



(૨૬)

ઘેરી ઘોલી, “સારું, તું મારી સાથે આવ, મને તારી જરૂર છે.”

ઘેરી અને હાથી સાથે ચાલ્યાં.



રરતામાં તેમને એક  
ખતક મળી.

ખતક ઘોલી, “સલામ, ઘેરી-  
બાઈ, તું કયાં જય છે?”

ઘેરી ઘોલી, “હું જંગલમાં જઉં છું, મારે લાકડાનું ધર  
ખાંધવાનું છે.”

ખતક ઘોલી, “હું સાથે આવું ?”

ઘેરી ઘોલી, “તું આવીને શું કરીશ?”

ખતક ઘોલી, “હું ધરની ફાટોને માટીથી પૂરીશ.”

ઘેરી ઘોલી, “સારું, તું મારી સાથે આવ, મને તારી જરૂર છે.”

પછી ઘેરી, હાથી અને ખતક એક બીજની પાછળ ચાલ્યાં.

કુવાની પાસે એક બળદ ઉલ્લો હતો.

તે માતેલો બળદ ઘોલ્યો, “સલામ, ઘેરીબાઈ, તું કયાં જય છે?”

(૩૦)

ઘેટી યોલી, “હું જંગલમાં જઉં છું, મારે લાકડાનું ધર  
ખાંધવાનું છે.”

તે માતેલો ખળદ યોલ્યો, “હું તમારી સાથે આવું.”

ઘેટી યોલી, “તું આવીને  
શું કરીશ?”



ખળદ યોલ્યો, “ધરને માટે  
તને માઠીની જરૂર પડશો;  
હું તારે માટે ઉંચકી

લાવીશ.”

ઘેટી યોલી, “સારે, તું પણ મારી સાથે આવ, મને  
તારી જરૂર પડશો.”

પછી ઘેટી, હાથી, ખતક, ખળદ ખધાં સાથે ચાલ્યાં.  
કેટલાક વખત પછી રહ્યે ચાલતાં તેમને એક  
મરધો મજયો.



મર ધો યોલ્યો,  
“સલામ, ઘેટીખાઈ,  
તું કયાં જય છે?”

ઘેટી યોલી, “હું જંગલમાં જઉં છું, મારે લાકડાનું ધર  
ખાંધવાનું છે.”

(३१)

મરદ્યો ઘાલ્યો, “હું તારી સાથે આવું?”

ઘેટી ઘાલી, “સાર્ચ, તું પણ મારી સાથે આવ. મારે  
તારી જરૂર છે.”

પછી તે પાંચે જણ સાથે જંગલમાં ગયાં.

તેઓ બધાં ત્યાં પહોંચ્યાં.

માટો હાથી આડેને પાડવા લાગ્યો.

નાની ઘેટી લાકડાનું ધર બાંધવા લાગ્યી.

માતેલો બળદ માટી લાવવા લાગ્યો.

ખતક ધરની ઝાંટો પૂરવા લાગ્યી.


મરદ્યો રોજ સવારે કુકરે કૂક કરીને ઘાલતો ગયો.

તે સાંભળી હાથી ઉઠ્યો.

ઘેટી ઉઠી.

ખતક ઉઠી.

બળદ ઉઠ્યો.



કેટલાક દિવસ પછી ધર  
તૈયાર થયું.

એ ધર ધણું સુંદર હતું.


નાની ઘેટી ઘાલી, “હાથી-  
રાજ, હું તારો ઉપકાર  
માનું છું.

(३२)

भरधा, हुं तारो उपकार मानुं छुं.  
 खण्ड भाई, हुं तारो उपकार मानुं छुं.  
 खतक, हुं तारो उपकार मानुं छुं.”  
 नानी धेटी आ सुंदर धरमां धणां वर्ष सुधी सुभी रही.

### वार्ता बारभी रामानी धेटी

अङ्क हिवसे रामो अने तेनी धेटी रमबा गयां.  
 तेच्या रमतां रमतां खडुज रम्यां.  
 पछी रामाने धेर जवानुं मन थयुं.  
  
 पण् धेटीकुमे करी धेर आवी नहि,  
 कुमके धेटीने धास खावानुं मन हतुं.  
 रामो घाल्यो, “माराथी हुमणां धेर जवाशे नहि,  
     कुमके भारी खराख धेटी धेर आवती नथी.”  
 पछी रामो रहवा लाग्यो, ने त्यांज घेटो.



त्यां अङ्क मातेलो खण्ड आव्यो.  
 रामो घाल्यो, “भारी धेटी होडी  
     गाई छे, धेटी धेर आवती

(33)

નથી, માટે હું રડું છું.”

ખળદ બોલ્યો, “રામા, રડીશ નહિ. હું ધાણો મોટો અને ખળવાન છું, હું ઘેટીને પકડી ઘેર લાવીશ.”

ખળદ ઘેટીની પાછળ હોડ્યો.

ખળદ હોડી હોડીને ખૂખૂજ હોડ્યો.

પણું ખળદથી ઘેટી ઘેર લવાઈ નહિ.

પછી ખળદ પણું રડવા લાગ્યો.



ત્યાં એક ઊંચું ઊંટ આવ્યું.

ઊંટે કહ્યું, “ખળદ, તું કેમ રડે છે.”

ખળદે કહ્યું, “રામો રડે છે, માટે હું રડું છું. રામો રડે છે, કારણું કે તેની ઘેટી જતી રહી છે. તે કેમે કરી ઘેર આવતી નથી.”

ઊંટ બોલ્યું, “રામા, તું રડીશ નહિ, હું ધાણું મોટું અને ખળવાન છું; હું ઘેટીને ઘેર લાવીશ.”

ઊંટ ઘેટીની પાછળ હોડ્યું.

ઊંટ ખૂખૂજ જડપથી હોડ્યું, પણું ઘેટી આમ હોડે તેમ હોડે, પણું ઘેર આવે નાહું.


(૩૪)

પણી ઊંઠ પણુ રડવા લાગ્યું.

રામો રડવા લાગ્યો.

ખળદ રડવા લાગ્યો.

ત્યાં આગળ એક ચપળ ઘોડો આવ્યો.



ઘોડો બોલ્યો, “અરે ઊંઠ, તું  
કેમ રડે છે?”

ઊંઠ બોલ્યું, “આ ખળદ રડે  
છે, તેથી હું પણ રડું છું.”

ખળદ બોલ્યો, “આ રામો રડે છે, તેથી હું પણ  
રડું છું.”

રામો બોલ્યો, “મારી ઘેરી જતી રહી છે, તે ઘેર  
આવતી નથી, માટે હું રડું છું.”

ઘોડો બોલ્યો, “રામા, તું રડીશ નહિ, હું ખળદ કરતાં  
અને ઊંઠ કરતાં ચપળ છું, તેથી હું તારી ઘેરને  
ઘેર લાવીશ.”

ઘોડો સર્વ કરતાં ખડુજ  
ઝડપથી હોડ્યો.

પણ ઘેરી આમ વળે તેમ વળે,  
પણ ઘેર આવે નહિ.



(૩૫)

પછી ઘોડો પણ રહવા લાગ્યો.

ત્યાં એક આનંદી મધમાખી ઉડતી ઉડતી આવી.

મધમાખીને લાગ્યું કે કોઈને પણ કુઃખ થવું  
નેરુંચ્ચે નહિ.

તેથી તે બધાંને રહતાં દેખી પોતે કુખી થઈ.

મધમાખી બાલી, “અરે ઘોડા, તું કેમ રહે છે?”

ઘોડો બોલ્યો, “આ ઊંટ રહે છે, તેથી હું પણ રહું છું.”

ઊંટ બોલ્યું, “આ ખળદ રહે છે, તેથી હું પણ રહું છું.”

ખળદ બોલ્યો, “આ રામો રહે છે, તેથી હું પણ રહું છું.”

રામો બોલ્યો, “મારી ઘેરી હોડીને જતી રહી છે, તે  
ઘર આવતી નથી, તેથી હું રહું છું.”

મધમાખી બાલી, “રામા, તું રડીશ નહિ. હું બહુ  
નાની છું, પણ મને થોડું જ્ઞાન છે. હું તારો ઘેરીને  
ઘર લાવીશ.”

આ સાંભળી ઘોડો હસવા લાગ્યો.

ખળદ પણ હસવા લાગ્યો.

ઊંટ પણ હસવા લાગ્યું.

ઘોડો બોલ્યો, “તારાથી આ ઘેરી ઘર જવાની નથો.”

ઊંટ બોલ્યું, “તને હોડતાં તો જરાએ આવડતું નથો.”

ખળદ બોલ્યો, “તું ધણીજ નાની અને નખળી છે.”

(૩૬)

મધમાખી ગાળુગણુવા લાગ્યો.

તે ઘેઠીની પાછળ ઉડો.

ઘેઠી આમ દોડી તેમ દોડી, પણ મધમાખીએ તેને  
છાડી નહિ. ઘેઠી જ્યાં જય ત્યાં મધમાખોનું  
ગાળુગણુવું સાંભળેજ.

મધમાખી બોલી, “તું ઘેર ચાલ, નહિ તો હું તેને  
કરડીશ.”

ઘેઠી બોલો, “હવે મારે ઘેર જવું જેઈએ, નહિ તો  
મધમાખી મને ખરેખર કરડશે.”

તેથી તે ઘેઠી ઝટ ઘર તરફ

દોડી ગઈ.

આ જેઈ રામો હસવા લાગ્યો.

ને ઘેઠી પાછળ તે દોડતો ઘેર ગયો.

રામાને ધણ્ણો આનંદ થયો, ને તેને ઘેર જવાનું મહિયું.

રામો બોલ્યો, “નાની મધમાખી, તું ઘેઠીને ઘેર લાવી,  
તેથી હું તારો ઉપકાર માનું છું.”



## અનુભવાની શુદ્ધારણી અંગે પત્રોફોલેન્ડ

### સું એં અનુભવાની શુદ્ધારણી પત્રોફોલેન્ડ

૧. શુદ્ધારણી કાંપાંગ વિષ પાઠેનું, બાકુ ૧ લીટ., ચાંદીના કાંપાંગ ૨ લીટ., ચાંદી  
૨. શુદ્ધારણી કાંપાંગ વિષ પાઠેનું, ડિસ્ટ્રિક્ટ ૧ લીટ., ચાંદીના  
૩. શુદ્ધારણી કાંપાંગ વિષ પાઠેનું, ડિસ્ટ્રિક્ટ ૧ લીટ., ચાંદીના

૪. અનુભવાની શુદ્ધારણી-શુદ્ધારણી-અનુભવાની; ડિસ્ટ્રિક્ટ, ચાંદીના, ચાંદીના ૧ લીટ.,  
ચાંદીના ૨ લીટ., ચાંદીના; શુદ્ધારણી વિષ, ૧ લીટ.

૫. અનુભવાની-શુદ્ધારણી-શુદ્ધારણી; ડિસ્ટ્રિક્ટ ૧ લીટ., ચાંદીના ૧ લીટ.

૬. શુદ્ધારણી શુદ્ધારણી-શુદ્ધારણી; ડિસ્ટ્રિક્ટ, ચાંદીના, ચાંદીના ૧ લીટ.;  
ચાંદીના ૧ લીટ., ચાંદીના ૧ લીટ., ચાંદીના ૧ લીટ., ચાંદીના ૧ લીટ.

૭. " એં " , ૧ લીટ., " એં " , ૧ લીટ., " એં " , ૧ લીટ.

૮. " એં " , ૧ લીટ., " એં " , ૧ લીટ., " એં " , ૧ લીટ.

૯. રિફ્રાનનો અનુભવાની, શુદ્ધારણી-શુદ્ધારણી, અનુભવાની, ચાંદીના ૧ લીટ.  
શુદ્ધારણી; ૨૦ ગ્રામીણ

૧૦. શુદ્ધારણી-અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧૦ ગ્રામીણ; ૨૦ ગ્રામીણ

૧૧. શુદ્ધારણી અનુભવાની અનુભવાની અનુભવાની અનુભવાની

૧૨. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.; ૨૦ ગ્રામીણ

૧૩. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૪. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૫. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૬. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૭. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૮. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૧૯. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૦. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૧. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૨. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૩. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૪. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૫. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

૨૬. અનુભવાની અનુભવાની, અનુભવાની, અનુભવાની ૧ લીટ.

